

અમારા દેશમાં 8 કરોડ લોકો દર વર્ષે પ્રવાસે આવે છે

સિટીરિપોર્ટર • ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, અમદાવાદ દ્વારા એમ્બેસેડર ઓફ ફ્રાન્સ ટુ ઇન્ડિયા, ફ્રેન્સોઈઝ રિચિયરનું 'ટકાઉ વિકાસ માટે નવી ટેકનોલોજીસ અને તકો: લેવરેજિંગ ધ ક્લાઈમેટ ચેન્જ ચેલેન્જ' વિષય પર લેક્ચર બુધવારે યોજવામાં આવ્યું હતું.

ટુરિઝમ ક્ષેત્રે સંભાવના

આ પ્રસંગે તેમણે ભારતનાં ટુરિઝમ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ભારતમાં 60-70 લાખ લોકો દર વર્ષે ટુરિઝમ માટે આવે છે. તો અમારા દેશમાં 8 કરોડથી વધારે લોકો દર વર્ષે ટુરિઝમ માટે આવે છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસની ખૂબ સંભાવનાઓ છે, છતાંય કોઈપણ દેશનાં લોકો અસુરક્ષિત અને પ્રદૂષિત દેશમાં જવાનું ટાળશે. તો મધ્યમથી લાંબાગાળા વિશે વિચારીએ તો સ્વચ્છ વાતાવરણ, ચોખ્ખું પાણી અને કાર્બનનાં ઓછામાં ઓછા સ્ત્રાવવાળો દેશ ટુરિઝમ માટે હબ બની જશે.



મેક ઈન ઇન્ડિયા પોલિસી

મારા મતે 'મેક ઈન ઇન્ડિયા' પોલિસી એક યોગ્ય નિર્ણય છે, કારણ કે ભારતમાં જ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સની બનાવટ કરવી અને જેનાથી ક્લાઈમેટ પર આડ અસર ન થાય તે રીતે બનાવવું તે એક પડકાર હોવા છતાંય ખૂબ જ મહત્વનો નિર્ણય છે. આર્થિક વિકાસના વિચારમાં ઇન્ડસ્ટ્રીઝ પર ધ્યાન કેન્દ્રિત કરાયું તે એક અગત્યનો માર્ગ બની રહેશે.